

શ્રી એમ.આર.દેસાઈ આર્ટ્સ એન્ડ ઇ.ઇ.લહેર
કોસાડિયા કોમર્સ કોલેજ, ચીખલી

એફ.વાય.બી.કોમ.સેમ. - ૨

વિષય : વાણિજ્ય સંચાલન - ૨

પ્રીપેડ બાય : - સંદ્યાકૌર અશોકસિંગ સરદાર

માર્ગદર્શક : - હેમાંગનીબેન દેસાઈ

અનુક્રમણિકા

1. અભિપ્રેરણ કે પ્રોત્સાહન કે પ્રેરણા અને થિયરી X અને Y
2. દોરવણી કે માર્ગદર્શન
3. નેતાગીરી (નેતૃત્વ)
4. માહિતી સંચાર
5. તાલીમ
6. ઇન્ટરનેટ અને વાળિજ્ય-૧
7. ઈવેન્ટ સંચાલન



એકમ -૧ અભિપ્રેરણ કે પ્રોત્સાહન કે પ્રેરણા અને થિયરી X અને Y

વ્યાખ્યા :-

“ઇચ્છિત કામ કરવા કોઈને કે પોતાને પ્રેરવાની કિયાને અભિપ્રેરણ કહી શકાય.”

- જરૂરિયાત – અગ્રતાક્રમનો માસ્લોનો સિધ્યાંત

આત્મસિક્ષિની જરૂરિયાતો

૪. પ્રતિજ્ઞાની જરૂરિયાતો

૩. પ્રેમની જરૂરિયાતો

૨. સલામતીની જરૂરિયાતો

૧. શારીરિક જરૂરિયાતો



□ હઝબર્ગનો દ્વિ-પરિબળ સિધ્યાંત

A. આરોગ્યના પરિબળો

- કપનીની નીતિ અને વહીવટ
- ટેકનિકલ સુપેરવિઝન
- સુપેરવિઝર સાથેના આંતરસંબંધો
- સાથી કર્મચારીઓના આંતરસંબંધો
- તાબેદાર સાથેના આંતરસંબંધો
- પગાર
- નોકરીની સલામતી
- અંગાત જીવન
- કાર્યાની પરિસ્થિતિ
- દરજજો કે મોભો

B. પ્રેરણાત્મક પરિબળો

- સિદ્ધી
- કદર કે સ્વીકૃતિ
- કાર્ય-સ્વયં
- વિકાસની સકયતા
- જવાબદારી



□ હર્જબર્ગના સિદ્ધાંત ની ટીકા

- પ્રેરણના પરિબળો પ્રોત્સાહક તરીકે કાર્ય કરસે તેવું હમેશા કહી સકાય નહિ
- આ નિયમ દરેક કર્મચારી માટે સાચો નથી
- બે પરિબળોમાં ભેદ પડવો મુશ્કેલ
- અન્ય લેખકો ટેકો આપતા નથી સંતોષ માપવો મુશ્કેલ છે
- આરોગ્યના કેટલાક પરિબળો પણ કર્મચારીઓને પ્રેરણા પૂરી છે .



અભિપ્રેરણના ઓજારો

A. વિદ્યાત્મક અભિપ્રેરણના ઓજારો

- પ્રશંસા અને કદર
- કર્મચારીઓના અંગાત પ્રક્રોમાં રસ
- હરિફાઈ
- ગાર્વની ભાવના
- જવાબદારીની સોંપણી
- નાણાકીય પ્રોત્સાહકો

B. નિષેધાભક્ત અભિપ્રેરણના ઓજારો

- નોકરી ગુમાવવાનો ૯૨
- અપકર્ષ
- પગરકાપ
- રજાકાપ
- આશિસ્ત માટે મેમો
- દંડ અથવા શિક્ષા



□ થિયરી X

સંચાલકોનો રૂઢિગત અને પ્રણાલિગત અભિગમ એ છે કે કામદારો કામચોર છે . તેમણે કામ કરવાનું ગમતું નથી. કામદારો સાથે કડકાઈથી અને ધમકીથી કામ લેવું પડે. સંચળકોના આ અભિગમને મેક્ઝોગરે સિદ્ધાંત X આવું નામ આપ્યું છે, જે કર્મચારીઓની નકારાત્મક ખાસિયતો પર ભાર મૂકે છે

□ થિયરી Y

જેમાં કામદાર સ્વભાવે આળસુ કે કામચોર નથી. તે ઉત્સાહી છે .તેને જવાબદારી સ્વીકારવાનું ગમે છે અને જો અનુકૂળ વાતાવરણ સર્જવામાં આવે તો તે સારી રીતે કામ કરે છે આમ સિદ્ધાંત Y કર્મચારીઓની હકારાત્મક ખાસિયતો પર ભાર મૂકે છે .

એકમ ૨ – દોરવણી કે માર્ગદર્શન

“તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી તેનું નામ દોરવાની“

- દોરવણીના લક્ષણો : -
 - સંચાલનની બધી સપ્તીઓએ થતું કાર્ય
 - સતત ચાલતી પ્રક્રિયા
 - પ્રત્યક્ષ દેખરેખનું તત્વ મહત્વનું
 - ક્ષેત્ર વ્યાપક
 - દોરવણી આપનાર સંચાલક નું કાર્ય કરે છે



□ દોરવણીનું મહત્વ

- દોરવણી સર્વચારીઓને માર્ગદર્શન આપી કાર્યમાં અકસ્તુતતા લાવે છે
- તેનાથી કામનું અને કામદાર નું મૂલ્યાંકન શક્ય બને છે
- તેને કરણે જ આયોજન અસરકારક બને છે
- દોરવણીને કારણે અકમની કાર્યક્ષમતા વધે છે
- દોરવણીને કારણે સહકાર અને સંકલન શક્ય બને છે



□ દોરવણીના માર્ગદર્શક સિધ્યાંતો

- ધ્યેયની સંવાદિતા
- હુકમની અકવાકયતા
- માહિતીની સમજૂતી અને અર્થઘટન
- પ્રત્યક્ષ નિરીક્ષણ
- દોરવણીની યોગ્ય પદ્ધતિની પસંદગી
- અસરકારક નેતૃત્વ
- અસરકારક માહિતીસંચાર
- માનવીના મહત્વનો સ્વીકાર
- નિશ્ચિત વિધિનો વિકાસ



એકમ – ૩ નેતાગીરી (નેતૃત્વ)

“પરસ્પરના એક ધોયની સિદ્ધિ માટે સ્વેચ્છાએ પ્રયત્ન કરવા લોકો પર અસર કરવાની પ્રવૃત્તિને નેતાગીરી કહેવાય છે”

❑ નેતાગીરીના લક્ષણો : -

- અનુયાયીઓ અથવા તાબેદારો
- નેતૃત્વનો સ્વીકાર
- સામાન્ય લક્ષણ
- કામગીરી સંબંધો
- હિતોની એકતા
- ગતિશીલ પ્રક્રિયા
- આદર્શ આચરણ
- પ્રોત્સાહન
- સતત પ્રક્રિયા



- નેતાગીરીના પદ્ધતિઓ : -
 - આપખુદ કે સરમુખત્યારશાહી નેતાગીરી
 - સહભાગીદારી કે પરસ્પર મસલત નેતાગીરી
 - છૂટોઢોર કે મુક્તવિહારની નેતાગીરી
- રેન્સીસ લિકર્ટની નેતૃત્વની ચાર સંહતીઓ
 - સંહતી – ૧ : - આપખુદ નેતૃત્વ
 - સંહતી – ૨ : - દયાળુ સાતલક્ષી નેતૃત્વ
 - સંહતી – ૩ : - મસલતી નેતૃત્વ
 - સંહતી – ૪ : - ભાગીદારી નેતૃત્વ

એકમ – ૪ માહિતીસંચાર

“જ્યારે કોઈ વ્યક્તિ અન્યના મનમાં અમૃક સમજ ઉભી કરવા માંગે ત્યારે તે જે કાઇ કરે છે તે બધાનો સરવાળો એટલે માહિતીસંચાર.”

❑ માહિતીસંચારના કક્ષણો : -

- હેતુલક્ષી પ્રક્રિયા
- દ્વિમાર્ગી પ્રક્રિયા
- આંતરિક પ્રક્રિયા
- કાયમી પ્રક્રિયા
- વહીવટી પ્રક્રિયા
- માનવીય પ્રક્રિયા
- સપ્તીનો તફાવત
- માહિતીસંચારના અનેક પ્રકારો



□ માહિતીપ્રેષણ : -

“માહિતીપ્રેષણ એ એક પ્રેયક્રિયા છે જેમાં તળસપ્તીના કામદારોના કાર્યને લગતા અહેવાલો તેઓના ઉપરી અધિકારીઓ દ્વારા ઉંચ્ય સંચાલનને મોકલવામાં આવે છે, તેમ ટોચના સંચાલકો તરફથી ઉપયોગી માહિતી નિરીક્ષકો અધિકારીઓ દ્વારા તળસપ્તીના કામદારોને પંહોચાય છે.”




□ માહિતીસંચાર જાળ / માહિતીસંચાર ની પદ્ધતિ અથવા તરાહો


- વર્તુળ
- સાંકળ
- ચક
- ‘Y’ સ્વરૂપની જાળ
- મુક્ત પ્રવાહ અથવા સર્વમાગ્ની




- ၁. အလုပ် : -




- २. सांकेतिक विश्लेषण :-




▪ એક :-



- ‘Y’ સ્વરૂપની જાળ



- મુક્ત પ્રવાહ અથવા સર્વમાળી




□ માહિતી સંચારનું મહત્વ

- સફળ સંચાલન
- અસરકારક હુકમો અને દોરવણી માટે
- ઉત્પાદકતામાં વધારો
- સંચાલનમાં અન્ય કાર્યોને મદદ
- કર્મચારી કાર્યસંતોષ
- નેતાગીરીના કાર્યોનો આધાર
- માનવીય સંબંધોની સ્થાપના



□ માહિતિસંચારના પ્રકારો



□ અસરકારક માહિતીસંચારને અવરોધતા પરિબળો

- સંદેશમાં વિકૃતિ
- ફેરબદલી થતાં અર્થમાં થતો ફેરફાર
- બેધ્યાનપણું
- ગાળણા
- અસ્પષ્ટ અનુમાનો
- ફેરફારને અનુરૂપ થવા યોગ્ય સમયનો અભાવ
- માહિતી આપનાર તરફ અવિશ્વાસ
- માહિતીસંચારનું અતિભારણ
- માહિતીના યોગ્ય કુમની અવગાણના
- અયોગ્ય માધ્યમની પસંદગી
- લાગણીની પ્રધાનતા
- કર્મચારી સંબંધો
- માહિતી આપવાનીજ નહિ
- અપરિપક્વ મૂલ્યાંકન

એકમ ૫ – તાલીમ

“તાલીમ એ કોઈ ખૂસ ઔદ્યોગિક કાર્ય કરવાને માટે જરૂરી કુશળતા ,વલણ અને જ્ઞાન વિકસાવવની અને તે અંગેની માહિતી આપવાની પદ્ધતિ છે”

□ તાલીમ ના ફાયદા : -

- ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો
- કર્મચારીઓનો વિકાસ
- ખર્ચમાં ઘટાડો
- થાકમાં ઘટાડો
- અક્સમાતમાં ઘટાડો
- નિરીક્ષણ ખર્ચમાં ઘટાડો
- બઢતી અને બદલીનું કાર્ય સરળ
- જુસ્સા માં વધારો
- મજૂર ફેરબદલી દરમાં ઘટાડો
- ગતિશીલતામાં વધારો
- ગુણવત્તમાં સુધારો
- નવા જ્ઞાન સાથે કદમ મિલાવી શકાય .




□ તાલીમની મર્યાદાઓ

- તાલીમ ખર્ચ પ્રવૃત્તિ છે
- તાલીમ લાંબી પ્રક્રિયા છે
- કર્મચારીઓનું ઉદાસીન વલણ કે વિરોધ કરવો
- તાલીમ માટે અલગ વિભાગ જરૂરી બને છે
- તાલીમનું મર્યાદિત કાર્યક્ષેત્ર હોય છે
- પેઢી પર ખર્ચનો નિરથી બોજો
- નાના કદના એકમ માટે તાલીમ અનુઝળ નથી
- ઉત્પાદન કાર્યમાં વિક્ષેપ કે ખલેલ પન્હોચે છે.



□ તાલીમની પદ્ધતિઓ




એકમ 6 – ઇન્ટરનેટ અને વાણિજ્ય -૧

□ ઈ-કોમર્સ ની વ્યાખ્યા : -

“વેપારી અને ગ્રાહક વચ્ચે થતી ચીજ-વસ્તુના વેચાણ અને ખરીદી અંગેની ઇન્ટરનેટ પર થતી પ્રક્રિયાને ઈ-કોમર્સ કહેવાય છે”

- ઈ-કોમર્સની ત્રણ પ્રણાલીઓ
 1. EM-ઇલેક્ટ્રોનિક માર્કેટ
 2. EDI-ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરચેંજ
 3. I-COM-ઇન્ટરનેટ કોમર્સ

□ તફાવત :- પરંપરાગત વેપાર અને ઈ-કોમર્સ



□ ઈ-કોર્પસની પદ્ધતિઓ

- B2C: - (બિઝનેસ ટુ કન્જુયુમર)

B2C માં એવા ઉત્પાદકોનો સમાવેશ થાય છે ,જે ડિજિટલ માહિતીના સમાનનું વિતરણ કે વેચાણ કરતા હોય છે . આ ડિજિટલ વસ્તુ કે સમાનમાં ન્યૂઝ,આર્ટિંકલ્સ,મુઝિક,પુસ્તકો કે વિડીઓનો સમાવેશ કરી શકાય .

- B2B: - (બિઝનેસ ટુ બિઝનેસ)

B2B માર્કેટિંગ એ એક એવો પ્રકાર છે જેમાં કોઈ એક ઉત્પાદક કે વેપારી ઇન્ટરનેટ પર પોતાનો વેપાર અને વ્યાપારી વ્યવહાર અન્ય કોઈક ઉત્પાદન કંપની કે વેપારી સાથે કરે છે

- C2C: - (કન્ઝુયુમર ટુ કન્ઝુયુમર)

આ પ્રકારના ઈ-કોમર્સના સોદામાં એક વાપરનાર પાસેથી જુની મોટર કાર વેચાવી છે તો કન્ઝુયુમર એક્ષેન્જની કોઈ વેબસાઇટ પર ગ્રાહક વેચાણ ની જાહેરાત આપે રસ ધરાવતા સંભવિત ગ્રાહકો તે માટે ઓફર મોકલશે તેને આધારે આ ગાડીનો સોદો થાય છે તેને C2C કહે છે

- B2G: - (બિઝનેસ તો ગવર્નમેન્ટ)

આ ઈ-કોમર્સ માં ધંધા અને સરકાર વચ્ચે વ્યવહારો થાય છે .ધંધે ભાગે ધંધાકીય પેઢીએ સરકારને વેરાઓ ભરવાના હોય છે .અંહી સેલ્સટેક્સ ઓફિસમાં ગયા વગાર વેપારી ઈ-બેન્કિંગની પછ્યતિ દ્વારા સેલ્સટેક્સ ભરી શકે છે

ઈ-કોર્મસ ના ફાયદા

A. કંપની /વેપારી પેઢીને : -

- વહીવટીખર્ચમાં બચત
- માલનો મોટો સ્ટોક જરૂરી નથી
- ઓછુ મૂડીરોકાન
- વધુ સારી ગ્રાહક સેવા
- નવી વસ્તુઓની રજૂઆત

B. ગ્રાહકોને ફાયદા : -

- પસંદગીનો વ્યાપક અવકાશ
- ઓછી કિમતે ખરીદીની તક
- શ્રેષ્ઠ સવલતોનો લાભ
- 24 કલાકની સેવાઓનો લાભ
- સમયની બચત



C. સમાજને ફાયદો : -

- રોજગારીની તકો
- સરકારની આવક માં વૃદ્ધિ
- શિક્ષણ વ્યાપારમાં વધારો
- અનેકવિધ વસ્તુઓનો ઉપયોગ



□ ઈ-કોર્મર્સ મર્યાદાઓ

- વ્યક્તિગત સંપર્કનો અભાવ
- વસ્તુ ચકાસવાનો મોક્ષો નાહિ
- બિનઅનુભવી વેચનાર
- પસંદગીમાં મુંજવણી
- ગુણવત્તા અને સેવામાં બેકાળજી
- ઉંચવર્ગ સુધી મર્યાદિત



□ ઔદ્યોગિક ક્ષેત્રો માટે ઈ-કોમર્સની તકો

- નાણાકીય સેવાઓ
- શેરબજાર
- બેંકિંગ સેવાઓ
- કાયદાકીય અને વ્યાવસાયિક સેવાઓ
- પ્રવાસન સેવાઓ
- આરોગ્ય સંભાડ



એકમ - ૭ ઈવેન્ટ સંચાલન

“ઈવેન્ટ અને તેના જુદા જુદા ઘટકોની ગોઠવણી તેમ જ તેના અમલીકરણ પ્રક્રિયા એટલે ઈવેન્ટ સંચાલન”

- ઈવેન્ટ સંચાલનનો ખ્યાલ અને લક્ષણો
 - હેતુલક્ષી
 - સર્જનાત્મક પ્રક્રિયા
 - વ્યાવસાયિક ક્રષિકોણ
 - પદ્ધતિસરની પ્રક્રિયા
 - જૂથ પ્રાયત્નો
 - યોગ્ય નેતૃત્વ
 - વિશાળ કાર્યક્રેત્ર
 - અસરકારક મર્કેટિંગ



□ ઇવેન્ટ સંચલનના તત્ત્વો કે ઘટકો

